


બિડાણ : સેકશન અધિકારીશ્રી, ફરિયાદી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય,
ગાંધીનગરના તા. ૨૪/૦૩/૨૦૨૨ ના પત્ર ક્રમાંક : પરચ/૧૨૨૦૨૨/૨૫૪/મ-૩ અને
નાયબ સચિવ(પેન્શન-તિબેરી), નાણાં વિભાગ, સચિવાલય,, ગાંધીનગરના
તા.૨૧/૦૩/૨૦૨૨ પત્ર ક્રમાંક: તજ૨/૧૦૨૦૨૨/૨૭૨/ઝ

વિષય : New Income tax Rule introduced by Central Government vide
Income tax (25th Amendment Rules-2021) for the interest earned
in GPF for the deduction made in GPF account over the thresh
hold limit ie.5,00,000/- during the year 2021-22

ખ.નં.નકૃયુ/૨૭./એડીએમ-૩.૨/૩૭૦૭ /૨૦૨૨

તા.૧૧/૦૪/૨૦૨૨

સામેલ : ઉપર મુજબ


ડુલસચિવ
નવસારી ફરિયાદી યુનિવર્સિટી
નવસારી

નકલ સવિનય રવાના :

અત્રેની યુનિવર્સિટીના તમામ યુનિટ/સબ યુનિટના અધિકારીશ્રીઓ તરફ જાણ તેમજ

૨/- આ સાથે સામેલ સેકશન અધિકારીશ્રી, ફરિયાદી, ખેડૂત કલ્યાણ અને સહકાર
વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા. ૨૪/૦૩/૨૦૨૨ ના પત્ર ક્રમાંક : પરચ/૧૨૨૦૨૨/૨૫૪/
મ-૩ અને નાયબ સચિવ(પેન્શન-તિબેરી), નાણાં વિભાગ, સચિવાલય,, ગાંધીનગરના
તા.૨૧/૦૩/૨૦૨૨ પત્ર ક્રમાંક: તજ૨/૧૦૨૦૨૨/૨૭૨/ઝ ના પત્ર અન્વયે જાણ તથા અગલ સારૂ.



ક્રમાંક: પરચ/૧૨૨૦૨૨/૨૫૪/મ-૩
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,
સચિવાલય, ગાંધીનગર.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૮૪૯

Email : so-m3-agri@gujarat.gov.in

તારીખ : ૨૪/૦૩/૨૦૨૨

પ્રતિ,

- ખેતી નિયામકશ્રી, કૃષિ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.
- બાગાયત નિયામકશ્રી, કૃષિ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.
- રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- પશુપાલન નિયામકશ્રી, કૃષિ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.
- મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રી, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- ખાંડ નિયામકશ્રી, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી., બલરામ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય બીજ નિગમ લી., સેક્ટર ૧૦-એ, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, શ્યામલ રો હાઉસ, સેટેલાઇટ, અમદાવાદ.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય ઘેટાં અને ઊન વિકાસ નિગમ લી., ઉદ્યોગ ભવન, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થા લિમિટેડ, સાકાર-૭, ભોંયરું, એસ-૨ થી એસ-૪, નહેરુ બ્રિજ કોર્નર, આશ્રમ રોડ , અમદાવાદ.
- કુલ સચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ.
- ✓ કુલ સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, ઇરુ ચાર રસ્તા, દાંડી રોડ, નવસારી.
- કુલ સચિવશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.
- કુલ સચિવશ્રી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠા.
- કુલસચિવશ્રી, ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, એટીક બિલ્ડીંગ, બોરસદ ચોકડી, આણંદ કેમ્પ, આણંદ.
- કુલ સચિવશ્રી, કામધેનુ યુનિવર્સિટી, કર્મચોગી ભવન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર.
- સભ્ય સચિવશ્રી, રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ, કૃષિ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.

PS to R
MP



05 APR 2022

- સભ્ય સચિવ સહ સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- રજિસ્ટ્રારશ્રી, ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલ, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ.
- મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ, સહકાર ખાતું, કૃષિ ભવન, પાલડી, અમદાવાદ.

વિષય : New Income tax Rule introduced by Central Government vide Income tax (25th Amendment Rules-2021) for the interest earned in GPF for the deduction made in GPF account over the thresh hold limitie.5,00,000/- during the year 2021-22.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય નાયબ સચિવશ્રી, નાણા વિભાગના તા.૨૧/૦૩/૨૦૨૨ ના પત્ર ક્રમાંક:તજર/૧૦૨૦૨૨/૨૭૨/ઝ સાથે મળેલ એ.જી.ઓફિસ, રાજકોટના તા.૦૨/૦૩/૨૦૨૨ ના પત્રની નકલ આ સાથે સામેલ છે. સદરહુ પત્રમાં દર્શાવ્યા મુજબ ભારત સરકારના તા.૩૧/૦૮/૨૦૨૧ ના જાહેરનામામાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ ની રૂ.૫,૦૦,૦૦૦/- થી વધુની જી.પી.એફ. કપાતના વ્યાજ પર ટેક્સની કપાત કરવાની જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.

બિડાણ : ઉપર મુજબ

આપની વિશ્વાસુ,



(એમ. કિરણચંદ્ર)

સેક્શન અધિકારી

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

અગત્યનું

ક્ર.:તજર/૧૦૨૦૨૨/૨૭૨/૪

ગુજરાત સરકાર,

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૨૧/૦૩/૨૦૨૨

✓ પ્રતિ,
અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી,
સચિવાલયના સર્વે વિભાગો,
સચિવાલય,
ગાંધીનગર.

વિષય: New Income tax Rule introduced by Central Government vide Income tax (25th Amendment Rules – 2021) for the interest earned in GPF for the deduction made in GPF account over the thresh hold limit ie.5,00,000/- during the year 2021-22.


સંદર્ભ: એ.જી.ઓફિસ, રાજકોટનો તા.૦૨.૦૩.૨૦૨૨નો પત્ર.

શ્રીમાન,

ઉપર્યુક્ત વિષય પરત્વે સંદર્ભ દર્શિત પત્ર આ સાથે સામેલ રાખતાં જણાવવાનું કે, ભારત સરકારના Department of Revenue ના તા.૩૧.૦૮.૨૦૨૧ના જાહેરનામાથી વર્ષ ૨૦૨૧-૨૨ની રૂ.૫,૦૦,૦૦૦/- થી વધુની જી.પી.એફ. કપાતના વ્યાજ પર ટેક્સ લાગુ કરવામાં આવેલ છે.

પ્રસ્તુત બાબતે ભારત સરકારના તા. ૩૧.૦૮.૨૦૨૧ના જાહેરનામામાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ની રૂ.૫,૦૦,૦૦૦/- થી વધુની જી.પી.એફ. કપાતના વ્યાજ પર ટેક્સની કપાત કરવાની કાર્યવાહી કરવા આપના વિભાગ તથા વિભાગ હેઠળની તમામ કચેરીઓના ઉપાડ અને વહેંચણી અધિકારીઓને જાણ કરવા વિનંતી છે.

આપની વિશ્વાસુ,



(દિપલ હડિયલ)

નાયબ સચિવ(પેન્શન-તિજોરી)

નાણા વિભાગ

✓ બિડાણ: ઉપર મુજબ

22/3

Rizala
23/03/22

નાયબ સચિવ/સચિવ

૨૬૬/૫-૩
૨૩/૦૩/૨૨

A.C.S. AGPI
NO. 214
23/3/22

Shri Sachin
23.3.22

50-M

1/50-M-3

તમામ HOD ને

જરૂરી કાર્યવાહી કરવા માટેની આપની આજ્ઞા



सत्यमेव जयते

11719

मि-२५५

कार्यालय प्रधान महालेखाकार (लेखा एवं हकदारी), गुजरात
रेसकोर्स रोड, राजकोट - ३६० ००१

Office of the
Principal Accountant General (A&E) Gujarat
Race Course Road, Rajkot - 360 001

RP

Fund-1/GPF/New IT Rule/ 2060

Date: 02-03-22

To,
The Deputy Secretary
Finance department, Government of Gujarat,
Block No.4, 6th floor, New Sachivalay,
Gandhinagar - 382 010
Email: ds-ser-fin@gujarat.gov.in

Subject: New Income tax Rule introduced by Central Government vide Income tax (25th Amendment Rules-2021) for the interest earned in GPF for the deduction made in GPF account over the thresh hold limit ie. 5,00,000/- during the year 2021-2022.

Sir,

With reference to the above subject it is to inform that the Central Government has introduced new Income tax rule for making deduction of taxable interest earned over the deduction made towards the GPF contribution for the year 2021-22 vide (25th Amendment Rules-2021) over the thresh hold limit ie. 5,00,000/- during the year 2021-2022.(copy enclosed)

In this connection it is to inform that the above rule position may be intimated to all Department and DDO about the new Income- tax rule which is applicable in the current year.

Thanking you

Encl: As above.

Yours faithfully

[Signature]

Sr. Dy. Accountant General/FAV

S.O/2

[Signature]
8/3/22

Shri A.B.
op

15/3/22

01/27/22
15/3/22

MINISTRY OF FINANCE
(Department of Revenue)
(CENTRAL BOARD OF DIRECT TAXES)

NOTIFICATION

New Delhi, the 31st August, 2021

INCOME-TAX

G.S.R. 604(E).—In exercise of the powers conferred by the first proviso to clause (11) of section 10 and the first proviso to clause (12) of section 10 read with section 295 of the Income-tax Act, 1961 (43 of 1961), the Central Board of Direct Taxes hereby makes the following rules further to amend the Income-tax Rules, 1962, namely:—

1. Short title and commencement.—(1) These rules may be called the Income-tax (25th Amendment) Rules, 2021.
- (2) They shall come into force on 1st day of April, 2022.

13
210

2. In the Income-tax Rules, 1962, after the rule 9C, the following rule shall be inserted, namely:—

"9D. Calculation of taxable interest relating to contribution in a provident fund or recognised provident fund, exceeding specified limit.- (1) For the purposes of the first and second provisos to clauses (11) and (12) of section 10, income by way of interest accrued during the previous year which is not exempt from inclusion in the total income of a person under the said clauses (hereinafter in this rule referred to as the taxable interest), shall be computed as the interest accrued during the previous year in the taxable contribution account.

(2) For the purpose of calculation of taxable interest under sub-rule (1), separate accounts within the provident fund account shall be maintained during the previous year 2021-2022 and all subsequent previous years for taxable contribution and non-taxable contribution made by a person.

Explanation: For the purposes of this rule,-

(a) Non-taxable contribution account shall be the aggregate of the following, namely:-

- (i) closing balance in the account as on 31st day of March 2021;
- (ii) any contribution made by the person in the account during the previous year 2021-2022 and subsequent previous years, which is not included in the taxable contribution account; and
- (iii) interest accrued on sub-clause (i) and sub-clause (ii),

as reduced by the withdrawal, if any, from such account;

(b) Taxable contribution account shall be the aggregate of the following, namely:-

- (i) contribution made by the person in a previous year in the account during the previous year 2021-2022 and subsequent previous years, which is in excess of the threshold limit; and

- (ii) interest accrued on sub-clause (i),

as reduced by the withdrawal, if any, from such account; and

(c) The threshold limit shall mean:

- (i) five lakh rupees, if the second proviso to clause (11) or clause (12) of section 10 is applicable; and
- (ii) two lakh and fifty thousand rupees in other cases."

[Notification No. 95/2021/ F. No. 370142/36/2021-TPL]

NEHA SAHAY, Under Secy. (Tax Policy and Legislation Division)

Note : The principal rules were published in the Gazette of India, Extraordinary, Part-II, Section-3, Sub-section (ii) vide number S.O. 969(E) dated 26th March, 1962 and were last amended vide notification number G.S.R. 578(E) dated 18th August, 2021.